ZEAL AQUA LIMITED CIN No: L05004GJ2009PLC056270

Date: 01/06/2023

To, **BSE Limited** Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 40000 I

- Scrip Code : <u>ZEAL/539963</u>
- Subject : Intimation of Newspaper Advertisement of Extract of Standalone Audited Financial Results for the Quarter and Year Ended 31stMarch, 2023
- Reference No. : Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Extract of Audited Financial Result for the Quarter and Year ended on 31st March, 2023 published in Newspapers on Thursday, 01st June, 2023.

1. English Daily: "Free Press Gujarat" dated 01st June, 2023.

2. Regional Language Daily: "Lokmitra" dated 01st June, 2023.

You are requested to kindly take the same on record.

Yours Faithfully, For Zeal Aqua Limited

PRADIPRUMAR RATILAL NAVI WHOLETIME DIRECTOR DIN: 01067716

SURAT GUJARAT LUS004GJ2009 PLC056270

Place: Surat

Encl: Copy of Newspaper



તંત્રીશ્રીની કલમે મહારાષ્ટ્રના ૧.૫ કરોડ ખેડૂતોને દર

વર્ષે મળશે ૧૨ હજાર રૂપિયા

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાજ્યના ખેડૂતો માટે બે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં નમો શેતકરી મહા સન્માન નિધિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. હવે, આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને પૂર્વમાં કે ૧૦૦૦ રૂપિયાની મદદ કરશે. આ સિવાય મહારાષ્ટ્ર કીબેનેટે ખેડૂતોને ૧ રૂપિયાના પાક વીમાનો લાભ મેળવવા સંબંધિત પ્રસ્તાવને પણ મંજૂર્ટ આપી દીધી છે. ખેડૂતોને ભેટ આપતી વખતે કેબિનેટે મંગળવારે આ બંને યોજનાઓને મંજરી આપી છે. રાજ્ય સરકાર વતી આ બંને યોજનાઓની તા કારણાવ્યા વ પૂછા ગાય છે. રાકવે સરકાર વસા ગા વેગે ચાકળાગાળા જાહેરાત વિધાનસભાના બજેટ સત્રમાં કરવામાં આવી હતી. હવે આ બંને યોજનાઓને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. નમો શેતકરી મહા સન્માન નિધિ યોજના હેઠળ મહારાષ્ટ સરકાર દ્વારા ખેડતોને દર વર્ષે ક,૦૦૦ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે. આ કેન્દ્ર દ્વાર વેડૂતોને આપવામાં આવતી મદદ કરતાં અલગ હશે. કેન્દ્ર સરકાર પહેલાર્થ . ખેડતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની સન્માન નિધિ આપે છે. હવે જો કેન્ડ ુ પદ્ધાં પાડે પર મેડે કે જે સરસાર માં આવતાં માં પાડા પાડે ગુડ્ડ કે જે હું છે. અને રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતાં આ સહાયની રક્ષમ જે જોડવામાં આવે તો દર વર્ષે સરકારો દ્વારા ખેડૂતોને ૧૨,૦૦૦ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે. એટલે કે ર-ર હજારના ઉદ્ધામાં આ રક્ષમ ખેડૂતોને ડવામાં આવશે. આ યોજના માટે સરકારને ૬૯૦૦ કરોડ વર્ચ થશે અને આ યોજનાથી રાજ્યના લગભગ ૧.૫ કરોડ ખેડૂતોને ફાયદે થશે. સાથે જ ખેડુતો માત્ર એક રૂપિયામાં તેમના પાકનો વીમો પક્ષ મેળવી પચ. સાયે ૦ "પુગ્રામાં ગયે જગમાં ગામના પાત્ર પાત પાત્ર મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. યોજનાનો લાભ મે માટે, અરજદાર ખેડૂત મહારાષ્ટ્રનો કાયમી નિવાસી હોવો જરૂરી છે.

BCCI એશિયા કપ માટે પાક.ના હાઇબ્રિડ મોડેલનં સમર્થન નહીં કરે તેવી પ્રબળ શક્યતા

નાડેલ્ડ્રુપું સમયના 'પછા કેટ એર પાયા પ્રબાગ સાઉતાના નવીદિલ્લી, ભારતીય કેટલે છે લે આગામી એવિયા કપ માટે પાકિસ્તાન બોર્ડના વડા નજમ શેઠીએ સુચવેલા હાયબ્રિડ મોડેલનું સમર્થન નહીં કરે તેવી પ્રબળ શક્યતા છે. પાક. બોર્ડ તારા એવિયા કપ માટે જે હાયબ્રિડ મોડેલનું સૂચન કરાયું હતું તે મુજબ થાર પ્રારશિય કપે અને સુપર કોર રાઉતન્તી બે મેચો પાકિસ્તાનમાં વોજવા જણાવાયું હતું જ્યારે ભારતન્તી મેચો તથા ફાઈનલ તટસ્ય સ્થળે સ્માડવા જણાવાયું હતું. એશિયન ક્રિટેટ શારે બાદ કોઈનલ તટસ્ય સ્થળે સ્માડવા જણાવાયું હતું. એશિયન ક્રિટેટ શારે બાદ કોઈનલ અને બી સીસીબાઈના કેટેટરી જય સાહે અમદાવાદમાં આઈપીએલ ફાઈનલ પૂર્વે ઇપ્પંડના કેટલાક બોર્ડ સભ્યો સાથે વાતચીત કરી લોવાનું માનવામાં આવે છે. જેઓ જ શારે ભારડીમાં અને કા વારા છે. આજના છે. આવે છે. જેમાં જય શાહે ભારતીય બોર્ડના વલણ અંગે સ્પષ્ટતા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એશિયા કપને તટસ્થ સ્થળે રમાડવા માટે એસીસી દ્વારા અંતિમ નિર્હાય લેવાશે. એસીસી એક્ઝિક્યુટિવ બોર્ડ બેઠકમાં આગામી સમયમાં નિર્હાય લેવારો અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અક્ષાનિસ્તાને પાકિસ્તાનમાં મેચ રમવા મુદ્દે તેમને કોઈ વાંધો નહીં હોવાનું પીસીબીન જાયાવું છે. જે આતરીય બોર્ડે પાક ના હાયબ્રિડ મોઠવનું સમર્થન કર્યું નથી. એસીસી એક્ઝિક્યુટિવ બોડીમાં રપ સબ્યો છે જેમાં પાંચ સાયન્ય કુલું હતા. ગયાલા બાઝઝકુલુદાર વાઝવા ૬ સવા છે જે વા સ્વ ટેસ્ટ રમતા દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અં અફધાનિસ્તાનનો સમાવેશ થાય છે તેમજ ગણ વન-ડે અને ટીર૦નો દરજ્જો ધરાવતા તથા ૧૭ ફક્ત ટીર૦ રમતા સભ્યોનો સમાવેશ થાય છે. એસીસીના સભ્યએ જણાવ્યું હતું કે, એશિયા કપ મામલે કોઈ વચગાળાનો રસ્તો શોધવો જરૂરી છે તેના માટે વોટિંગ કોઈ વિકલ્પ નથી.

ઈજામાંથી સ્વસ્થ થઈને પુનરાગમન માટે સજ્ર થઈ રહ્યો છે જસપ્રિત બુમરાહ

મેરાજ પે પ્રયા ૯ ટે રામત્મ નુમાર પ્રાપ્ય નવીદિલ્હી, ઉંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિય ૨૦૨૩ની ફાઇનલ મેચ રમવાની છે. આ મેચ ૭ બુનથી ૧૧ જૂન સુધી રમાશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાઈ ઉંગ્લેન્ડ પહોચી ગયા છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર કાસ્ટ ભોલર જસ્થિતિ ભુમરાહ ડૂંટ સમયમાં પુનરાગમન કરે તેવી શક્યતા હવે પ્રભળ બની ગઈ છે. ભુમરાહ છેલ્લા કેટલાક સમયથી ઇંજ ખેખ -પ્યો ગ્લા છે. જસ્થપિત ભુમરાહ ટૂંટ સમયમાં પુનરાગમન કરે તેવી શક્યતા હવે પ્રભળ બની ગઈ છે. ભુમરાહ છેલ્લા કેટલાક સમયથી ઇંજ તથા શરૂરતા હચ પ્રયંગ ભગા ગઇ છે. ભુનસાઢ છલ્લા ક્રવ્લાક સ્વત્યા ઇજા સામે ઝ્યુમી રહી છે. જરાદીત ભુગરાહ અંતિવ બગાન બેદાન પર ગયા વર્ષે જોવા મળ્યો હતો પરંતુ વર્દ ટેસ્ટ ચેમ્પિયનશિપ કાઇનલ અગાઉ ભુમરાહે પોતાની ઇજા પર એક અપંદેટ આપ્યું છે. ભુમરાહે ઇસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે જેમાં પુનરાગમનના સંકેત ગાપ્યા છે, તેને એક જૂતાની તસવીર શેર કરતા કેપાનમાં બધ્યું છે કે હેલો મિત્રો, આપથે હરી મળી રહ્યા છીએ. જસપ્તિ ભુમરાહની આ પોસ્ટ પછી અટલળો લાગી રહી છે કે તે ઝપથી ગેમાં તેમાં તેમ તેમ તેમ ગેમાં શ કાઇસ્ટચર્ચ શહેરમાં પીઠની સર્જરી થઇ હતી. આ સર્જરી ક્રાઇસ્ટચર્ચમાં ફોર્ટ ગોથોપેડિક્સ હોસ્પિટલના એક જાણીતા ઓથેપિડિક સર્જન ડૉ. રોવન સ્કાઇટને આયોપાડક્સ હાાસ્યટલના એક જશાતા આયોપાડક સંજ ન ડા. રાવન સ્કાટરન કરી હતી. બુમરાહને સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા છ મહિના લાગશે. માનવામાં આવી રશુ છે કે આ વર્ષના અંતમા યોજાનારા આઇસીસી વન ડે વર્લ્ડક્ય ૨૦૨૩ સુધી જસપ્રિત બુમરાહ આતંરરાષ્ટ્રીય ક્રિટેટરાં પરત આવે વન ડે અને ૯૦ ટી-૨૦ મેચ ૨મી છે, તેલે ટેસ્ટમાં ૧૨૮ વિકેટ, વન ડેમાં ૧૨૧ વિકેટ અને ટી-૨૦મેચ ૨મી છે, તેલે ટેસ્ટમાં ૧૨૮ વિકેટ, વન ડેમાં ૧૨૧ વિકેટ અને ટી-૨૦માં ૭૦ વિકેટ ઝડપી છે. તે ભારતના સૌથી સફળ બોલરમાંથી એક છે.

સિંહને ઇતરડીથી લઈ પેટના ક્રમિ સામે પણ રક્ષણ મળે એ માટે મારણમાં દવા અપાઇ

અમરેલી, ગિરસોમનાથ અને જુનાગઢ જીલ્લો ગીર વિસ્તારની અંદર ગણવામાં આવતો વિસ્તારને ગણવામાં આવે છે. આ વિસ્તારની અંદર વન્ય પશએ અને પ્રાણીઓનો ખૂબ જ વસવાટ છે ગીર સિંહનું નિવાસસ્થાન ગણવામાં આવે છે. ચોમાસા પહેલા ગીર પૂર્વે પાંચ રેન્જમાં વનતંત્રની એક ઉત્કૃષ્ટ કામગીરી શરૂ કરવામ પાવી છે. સિંહને ઇતરડીથી લઈ પેટના કુમિ સામે પણ રક્ષણ વધા છે. દવા આપવામાં આવી છે. મનીપ ઓડેદરા જાણાવું કે, બે વર્ષથી સિંહ માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોગ્રામમાં મરણમાં દવા આપવામાં આવે છે. સિંહના શરીર પરથી પણ મળે છે તેથી હિમોચ્લોબીન ઘટે છે અને બાદમાં માંદગીનો લાજી માં સાથે વધા જાય ગળ છાવ્યા છા માન્યાળ્યા પછ છે જે ગયા છા માછ્યમાં ભોગ સિંહ બંને છે જેવી આ દવાઓ સિંહને મારણમાં આપવામાં આવી રહી છે અને ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. હબાબાદીયા રેન્જમાં ૨ ર સિંહ, સરસીયા રેન્જમાં ૫, જસાધાર રેન્જમાં ૨૦, હડાલા રેન્જમાં ૨ અને તુલસીશ્યામ રેન્જ ર જાય ૧, જાયાર ૬ જયા ૬૦, અન્યા ૬૦૧૫ ૬૦૧૫ ૬ બાય પુરસાયમાં ૧૯૦ વિસ્તારમી અંદર વસતા સિંહને મારણાની અંદર પ્રધાસ દવા ગાપવામાં આવી રહી છે અને ખાસ પ્રોગ્રામનું આયોજન કરી અને સિંહની સાચવણીનો ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા ડિવોમિંગ કાર્યવાહી એક સપ્તાહથી શરૂ કરવામાં આવી છે. સિંહ પરિવાર જ્યારે બળદ, ગાય, ભેંસ અને નીલગાય જેવાં પ્રાણીઓનો મારણ કરે ત્યારે મોરબી પાલીકાનો સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને માલમાં જ દવાઓ ભેળવી દે છે.

સાક્ષીની હત્યા લવ જેહાદ છે: હંસરાજ હંસ

સુનાવલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ.સચદેવાએ કહ્યું કે, શાહબાદમાં સાહિલ સરફરાઝ દારા દિલ્હીના શાહબાદમાં ખુલ્લેઆમ એક સગીરની હત્યાને શાહબાદમાં લઈને રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ સાક્ષીની હત્યાને લવ જેહાદ ગણાવ્યું છે. હિંદુ યુવતીની ક્રૂર હત્યાએ ફરી એકવાર બતાવ્યું છે કે દિલ્હીમાં લવ જેહાદ ફરી વળ્યો છે. તેણે કહ્યું, દરમિયાન, મંગળવારે ભાજપના લો કસભા સાંસદ હંસરાજ હંસ પીડિત 'સાહિલ સરકરાઝના હાથ પર પાક્સખા સાસ્ટ હસ પાડા પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારને બાંધેલી લાલ બ્રેસલેટ સ્પષ્ટપણે દર્શાવે આર્થિક મદદ પણ કરી છે અને કહ જે સુનિયોજિત રીતે કામ કરી રહી આાથક મદદ પક્ષ કરા છે અન કહ્યુ છે કે તે પરિવારને ન્યાય અપાવવામાં પક્ષ મદદ કરશે. હંસરાજ હંસે સાક્ષીના પરિવારને ૧ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. પીડિતાના પરિવારને મળ્યા ભાદ હંસરાજ હંસે મીડિયા સાથે વાત કરતા 62 રાજકીય તુષ્ટિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.બીજેપી નેતા કપિલ મિશ્રાએ હત્યાની તુલના શ્રદ્ધા વાલ્કર કેસ સાથે કરી છે. તેમણે કહ્યું, ''આ દર્દનાક હત્યા દિલ્હીમાં થઈ છે. શ્રદ્ધાને હજુન્યાય મળ્યો નથી. ન જાણે હજુ કેટલી શ્રદ્ધા આવી ક્રૂરતાનો શિકાર થશે.બીજી તરફ, દિલ્હીના કહ્યું, ''અમે તેની જગ્યાને તો ભરપાઈ કરી શકતા નથી, પરંતુ અમે આર્થિક મદદ કરીશું. આ એક નાનો ચેક છે. બતાવવો તો ના જોઈએ પણ તમે બોલો છો એટલે બતાવી દઈએ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારને દશ લાખની સહાય કરવાની જાહેરાત કરી છે. અરવિંદ જ્યારે સાક્ષીની માતાએ ફરી એકવાર ગુનેગારને ફાંસીની સજા થાય તેવી કેજરીવાલે લેક્ટનન્ટ ગવર્નર વીકે ક કરાયાલ વર્સ્ટરાપ્ટ ગયતર માક સક્સેના પર નિશાન સાધ્યું અને ટ્વીટમાં કહ્યું, "દિલ્હીમાં એક સગીર છોકરીની નિર્દયતાથી હત્યા કરવામાં માંગ કરી છે. બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટી અને બીજેપી સામસામે આવી ગયા છે. અને આવી. આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્થ છે. ગુનેગારો નિર્ભય બની ગયા છે. પોલીસનો કોઈ ડર એકબીજા પર આરોપો લગાવી રહ્ય છે. ભાજપના નેતાઓએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને તેને લવ

દિલ્હી

જેહાદ ગણાવી છે. ભાજપના દિલ્હી એકમના ાવા. ગલ્લ સાહળ, કાયદા અન વ્યવસ્થા તમારી જવાબદારી છે, કંઈક કરો." અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ એક

. નિવેદનમાં કહ્યું કે આ કેસની પાકિસ્તાન, પાકિસ્તાનની પરિસ્થિતિ વિશ્વમાં જાણીતી બની ગઈ છે. વાસ્તવમાં, પોતાના ઈસ્લામિક મિત્ર કહેવાતા મલેશિયાએ ફરી એક વખત પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનાબોઈગ ૭૭૭ પેસેન્જર જેટને બાકી ચુકવણી ન કરવા બદલ જપ કરી લીધું છે. બંને દેશો વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે, આ પછી પણ કે તે લવ જેહાદ ગેંગનો સભ્ય છે મલેશિયા પાકિસ્તાનના મોઢા પર જોરદાર થપ્પડ મારે છે. એક રિપોર્ટ અનુસાર બોઈંગ ૭૭૭ એરક્રાફ્ટ^{*}છ સચદેવાએ કેજરીવાલ પર દ્વારા મલેશિયા સાથે લીઝ એરેન્જમેન્ટ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. પેસેન્જર જેટને ઇં૪ મિલિયનની બાકી ચુકવણી ન કરવા બદલ કથિત રીતે જેપ્ન કરવામાં આવ્યું. એવું કહેવામાં

નથી. એલજી સાહેબ. કાયદો અને

૨૬/૧૧ હુમલામાં સામેલ આતંકવાદીનું પાર્કિસ્તાનની જેલમાં મોત

વિઝનલ ઓફિસ, ભાવનગર પરા-36400: -: Wi118/NIT/E-Tender/2023-24/WA 4 તારીખ 25.05.2023. ઈ-ટેન્ટર નં. 7/2023-24 to 20/2023-24. ટેન્ડરની (ગતો નીચે મુજબ છે. સં. ક. 1 ઈ-ટેન્ટર નં. 7/2023-24 કામનું નામ: ભાવનગર:-ઇટીએસની હોસ્ટેલમાં વધારાની પધારે

ા(₹): 34,600.00 2023-24 કામનું

નામ: હાસ્ટેલમાં વધારાતના જોગવાઈ કરવાનું કામ. કેન્ટ 7.30,514.57, ઈએમડી(ર): 34,6 2 ઈ-ટેન્સ્ટ નં.: 18/2023-?' ડીઇએન- ટ્રુપાર ટ્રી/ કાર-'

.000.00, ઈએમડી(4 ઈ-ટેન્ડર નં

અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-અંગે આપવામાં આવેલી માહિતીમાં અને આતકવાદો સગઠન લશ્કર-અ-તૈયબા સાથે જોડાયેલા અબ્દુલ સલામ બુટાવીનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું છે. અબ્દુલ સલામ ભુટાવીએ આતંકવાદીઓને તૈયાર કરવામાં મદદ કરી હતી, જેમણે ૨૦૦૮ના જણાવવામાં આવ્યું હતું કે, અબ્દુલ સલામનું સોમવારે બપોરે સલામનુ સામવાર બપાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતની શેખપુરા પાકસાણપા પઢળ પ્રાણા રાખવુરા જેલમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. લશ્કર સાથે જોડાયેલા એક સંગઠને ૭૮ વર્ષીય આતંકવાદી મુંબઈ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. તે આતંકવાદી ભંડોળ માટે પાકિસ્તાનની જેલમાં સજા કાપી ભુટાવીના અંતિમ સંસ્કાર દર્શાવતો વીડિયો પણ જાહેર કર્યો છે. ભુટાવીના અંતિમ સંસ્કાર આજે મંગળવારે રહ્યો હતો.અબ્દુલ સલામ ભુટાવીને વર્ષ ૨૦૧૨માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષો સવારે લાહોર નજીક મુરિદકેમાં આતંકવાઠી જૂથના 'મરકઝ' કેન્દ્રમાં કરવામાં આવ્યા હતા.ભારતીય ગુપ્તચર અધિકારીઓએ પણ પછી. ભટાવીને પાકિસ્તાન દ્વારા ટેરર

'?;¢ંડિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ ગુતચર આપકારાઓ અ ધયા આતંકવાદી ભુટાવીના મોતની પુષ્ટિ કરી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે આ કેસ વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ ૩ વર્ષ પહેલા લશ્કરના સ્થાપક કસ્તાવશા વગતવાર માહિતા ઉપલબ્ધ નથી. નવે મ્બર ૨૦૦૮માં, ૧૦ લ શ્કર - અં - તે ય બા ના આતંકવાદીઓએ મુંબઈમાં અનેક સ્થળોએ આતંકવાદી હુમલા કર્યા હતા, જેમાં અમેરિકા અને ઈઝરાયેલ હાફિઝ સઈદના સાળા અબ્દુલ રહેમાન મક્કી સાથે ટેરર ??ફંડિંગના કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ભુટાવીને ઓગસ્ટ ૨૦૨૦માં સાડા ૧૬ વર્ષની સજા ફટકારવામાં જેવા અનેક દેશોના નાગરિકો સહિત આવી હતી.લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને ૨૦૦૨ અને કુલ ૧૬૬ લોકો માર્યા ગયા હતા, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા ૨૦૦૮માં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ હતા. બાદમાં પાકિસ્તાને હુમલા માટે નીંના કાર્યકારી વડા તરીકે કરવ પશ્ચિમ રેલવે-ભાવનગર ડિવિઝન બજાવતા ભુટાવીના મૃત્યુની સોમવારે મોડી રાત્રે, આતંકવાદ સાથે જોડાયેસ રધારાની પથારીની જોગવાઈ, વરસાદનું પાણ <u>કીચડ/ગારો કાઢવા ડિઝલ પમ્પ ભાડે કરવા</u> <u>વિવિધ પી.વે પ્રવ</u>ૃત્તિઓ

પશ્ચિમ રેલવે-રાજકોટ ડિવિઝન <u>ક્રેઈટ/વેગન નિભાવ સુવિધાઓનું અપગ્રેડેશન</u> ઈ-ટેન્ડર નોટીસ નં. 08 of 2023-24 તારીમ 3 26.05.2023 ઓફિસનું સરનામું: ડિવિઝનલ ટેલવે મેનેજર (એન્જિ.), પશ્ચિમ ટેલવે, ડોડી કરપાલ્ટ, રાજદોર, ગજરાત-360001 આ કન્યાહન્ગ, રાજકોટ, ગુજરાત-36000 ભરાઈટ: <u>www.ireps.gov.in</u> (01) ઈ-ટેન્ડ : DRM-RJT-23-E-20 કામનું નામ : હોયા ઇટ/વેગન નિભાવ સુવિધાર્ગનું ગાયડોટા રાતું કામ. અંકાજિત એનઆઈટી પડતર 5,17,75,280.68 ટેન્ડર ઓલવાની તારી! ને સમય: IBMS2073++ ≮ જ્યારે અને સમય: 16/06/2023ના 15.00 કલાકે. 23 અમલે લાઇક ડરો: 🛉 facebook.com/WesternRly

ભાડ કરવાયુ કર. મૂલ્ય(₹): 8,53,953.30, ઈ 00.00, સં. ક. 3 ઈ-ટેન્ડર નં.: **કામનું નામઃ** રકારક્ષેત્ર-(બિડેલ WESTERN RAILWAY - RAJKOT DIVISION DING ROOF TOP SOL AF Tender Notice No. DRM/RJT/E-Tendr 2023-2024/07(EL)Dt.27-05-202 Tender No. DRM/RJT/E-I202 2024/07 (I) Name of Work: Rajk Division: Providing roof top solar pow plant at various stations. (II) Appro Cost: ₹ 51,16,4451. (III) END Cos ₹ 1,02,2300-(IV) Date and time for on In sply-on 28-96-2023 up to 15.00 Hour

કામ. ટેન્ડર યૂલ્ય (ર): 1,15,37,230.1 ઈએમડી(ર): 2,07,700.00, ઉપરોક્ત બા ટેન્ડરો માટે: બીડીંગ શરૂ થવાની તારીંગ 05.08,2023, બીડીંગ બેથ થવાની તારીંગ 19.08,2023 બેનબાઈટી 25/05/2023ના ગે ટેવતેના ગે: apply: on 26-06-2023 up to (v) Address of the Offic Railway Manager (Electri Railway, Kothi Compound 001. Web site pa site pa Like us on: f facebook com/WesternRly ल्ल्ने ताहड इतेः 🚹 fa

NOTICE OF CLOSURE OF BRANCH MAGMA HDI GENERAL INSURANCE COMPANY LIN IRDAI Registration No. 149 dated 22nd May, 2012 Registrated Office : Development House, 24 Park Street, Kolkata - 7 CIN : U66000WB2009FLC138327 • Website : www.magmahdi.c MAGM

. nta - 70001 lers and public at large are hereby informed that ou nam (Gujarat) will be closed after 60 days of this notice. our customers/policyh wing branch in Gandh Gandhidham (Gujarat) Office No.-204, 2nd Floor, Goyal Avenue, Plot No - 318, Ward No. 12-B, pp- LIC Office, Banking Circle Road, Gandhidham, Kachchh, Gujarat - 370201

After the above mentioned period, any person having any queries or unresolved business with his tranch can conclude us al Magma BIO General Insurance Co Katira Complex, RTO Relocation, Opp to Fire Station, Madhapar Highway Bhuj, Gujarat - 370001. Reach us on 1800 266 3202 (Toll-Free) or email at customercare@magmach.dlc.co.in

દિલ્હી, ખતરનાક આતંકવાર્દી ઘણી સંસ્થાઓએ જાહેરાત કરી ઓપરેશન કમાન્ડર ઝકીઉર રહેમાન હાફિઝ સઈદના નજીકના સાથીદાર હતી.આતંકવાદી ભુટાવીના મોત લખવી સહિત લશ્કર-એ-તૈયબાના સાત લોકોની ધરપકડ પણ કરી હતી પરંતુ કેસમાં કોઈ ખાસ પ્રગતિ થઈ ભુટાવીને સપ્ટેમ્બર ન હતી. ૨૦૧૧માં યએસ ટેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તે છેલ્લા ૨૦ વર્ષથી લશ્કર-એ તૈયબા માટે ભંડોળની વ્યવસ્થા કરવા, લોકોની ભરતી કરવામાં અને લોકોને મદદ કરવા માટે જવાબદાર હતો

ખાતરી પર વિમાનને છોડવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલ PIA એરક્રાફ્ટને ૨૭ જાન્યુઆરીએ ૧૭૩ મુસાફરો અને ક્રૂ

૨૦૨૧માં કુઆલાલંપુર એરપોર્ટપર મેમ્બર સાથે પાકિસ્તાન પરત PIAનું વિમાન જપ્ત કર્યું હતું. બાદમાં લાવવામાં આવ્યું હતું.છેલ્લા બે વર્ષમાં બાકી રકમની ચૂકવણીની રાજદ્વારી બે વખત એરકાકટ જપ્ત થવાથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ માટે પડકારો સર્જાયા છે. લીઝનો મુદ્દો તેમને કાંટાની જેમ ડંખે છે કારણ કે

કામગીરી વારંવાર પ્રભાવિત થઈ રહી છે. એરલાઈનની નાણાકીય સ્થિરતા ડગમગી રહી છે. પીઆઈએના અધિકારીઓએ હજુ સુધી જપ્તી અને વિવાદ ઉકેલવા માટે લેવામાં આવનાર પગલાં અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

2



CIN: L05004GJ2009PLC056270 . 347, Vill. Orma, Ta: Olpad, Surat, Gujarat 394540 India Tel.: mail: zealagua@gmail.com, Website: www.zealagua.com

| | , | | | | | | |
|--|--|------------------------|------------------------|------------------------|------------------------|--------------------------------------|--|
| | Extract of Audited Financial Result for the Quarter and Year ended 31st March, 2023 Amount in Lakh except EPS | | | | | | |
| SI. | Particulars | Quarter | Quarter | Quarter | Year ended | Year ended | |
| No. | raruculars | ended 31 st | ended 31 st | ended 31 st | 31 st March | Tear ended 31 st March | |
| NO. | | March | December | March 2022 | 2023 | 2022 | |
| | | 2023 | 2022 | Warch 2022 | 2023 | 2022 | |
| | | (Audited) | (Unaudited) | (Audited) | (Audited) | (Audited) | |
| 1 | Total Income from Operations | (Audited) 6533 799 | 13381.070 | 10459.542 | (Audited) 36268 737 | (Audited) 34522.315 | |
| 2 | Net Profit / (Loss) for the period | 126.429 | 327.064 | 10459.542 | 817.922 | 718.815 | |
| 2 | (before Tax, Exceptional and/or | 126.429 | 327.064 | 145.259 | 817.922 | /18.815 | |
| | (before Tax, Exceptional and/or Extraordinary items) | | | | | | |
| 3 | Net Profit / (Loss) for the period | 126.429 | 327.064 | 145.259 | 817.922 | 718.815 | |
| 3 | before tax (after Exceptional | 120.429 | 327.064 | 145.259 | 617.922 | /10.015 | |
| | and/or Extraordinary items) | | | | | | |
| | and/or extraordinary items; | | | | | | |
| 4 | Net Profit / (Loss) for the period | 126.429 | 327.064 | 51,158 | 705.355 | 574.714 | |
| 4 | after tax (after Exceptional | 126.429 | 327.064 | 51.158 | 705.355 | 5/4./14 | |
| | after tax (after Exceptional and/or Extraordinary items) | | | | | | |
| 5 | Total Comprehensive Income | 126.429 | 327.064 | 51.158 | 705.355 | 574,714 | |
| 5 | for the period [Comprising | 126.429 | 327.064 | 51.158 | 705.355 | 574.714 | |
| | Profit / (Loss) for the period | | | | | | |
| | (after tax) and Other | | | | | | |
| | Comprehensive | | | | | | |
| | Income(after tax)] | | | | | | |
| 6 | Equity Share Capital | 1260.660 | 1260.660 | 1260.660 | 1260.660 | 1260.660 | |
| 7 | uation | - | - | - | 5.814.265 | 5.120.520 | |
| | Reserve) as shown in the | | | | -, | -, | |
| | Audited/Unaudited Balance | | | | | | |
| | Sheet of the previous year * | | | | | | |
| 8 | Earnings Per Share (face value | | | | | | |
| | of Rs. 10/-each) (for | | | | | | |
| | continuing and discontinued | | | | | | |
| | operations) | | | | | | |
| | 1. Basic | 0.100 | 0.259 | 0.041 | 0.560 | 0.456 | |
| | 2. Diluted | 0.100 | 0.259 | 0.041 | 0.560 | 0.456 | |
| Note: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Regulationer) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the vectorists of the Stock Exchange() at www.betendia.com and the listic entity at Remote Results are available on the vectorists of the Stock Exchange() at www.betendia.com and the listic entity at | | | | | | | |
| www.zearauta.cu.cu. 2.The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 30th May, 2023. 3.The figures for the quarter ended March 31, 2023 and March 31, 2022 are the balancing figures between audited figures in respect | | | | | | | |
| of the f | 5. The figures to the quarter ended match 31, 2023 and match 31, 2022 are the balancing rightes between adulted ingenes in respect of the full financial year and the published year to date figures up to the end of third quarter which was subjected to Limited Review. For Zeal Aqua Limited | | | | | | |
| | Sd | | | | | | |

dipkumar Ratilala Navil WHOLETIME DIRECTOR DIN : 01067716



Date: 30.05.2023 Place: Surat

કાઈના સ્વીમીટેડનું મામ હતું તે કહીની શ્રી સમ કાઈનાન્સ લીમીટેડ તા. ૩૦.૧૧.૨૦૨૨ ના રોજપી અમલ માં આવ્યુ છે. ૩૦.૧૧.૨૦૨૨ના રોજ આ નામ બદલાયું તેનું ઈન કોપેરેટેડ મા પ્રમાણયન મુજબ છે. સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (બેન્કોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ તા રૂલ ૮(૯) સાથે વંચાતા સિક્યોરિટાઇઝેશન અને રીડન્સ્ટ્રકશન ઓક કાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (બેન્કોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ તા રૂલિટ આ માટે ઈન્ડાજી વેચાજ નોટીસ. આથી ખાસ કરીને કડળટારો એ ને બીમાંગદારો એને એક ડેજનાને નોટિસ આપવાં આવે છે કે નીવે જ્યાવેલ સ્થાવર મિલકનો શ્રીરા કાયનાન્સ લિમિટેડને ગીરો ચાર્જ કરાયેલ છે જેને લોતિક કળ્યું શ્રી રામ કાયનાન્સ લિમિટેડના અધિકૃત અધિકારી એ લઇ લીધે છે, "શે વું જ્યાં છે", "છે છે" અને "જેમ છે"ના પોસ્ટ્રે નીસે કોપ્ટર્સના દ્વારા વેચા જામીનદારો પાસે થી શ્રીરામ કાયનાન્સ લીમીટેડની બાદી રક્ષના વસુલાત માટે ૦૩/૦૭/૨૦૨૩ નરોજ સ્વારે ૧૧ વાગ્યા થી ભપેર વાચ્યા ની વચ્ચે ઈન્હાસજદારો અને કરવામાં બાદ્યો કડળદારો એને જ્યોનદારોની વગતો, બાકી ટક્ષ્મ, સ્થાવર મિલકનની સંક્ષિત વિગત અને તેના પરના બોજા, કળ્યાનો પ્રકાર, રીઝર્લ કિમ્પ અને અનેસ્ટ મની દિપોઝીટ, હરાજકારો અને સામાય થવાની વચ્ચે છે.

| ા) તા પાર્ટ પારસ ઘાર, (રૂપિયા પચાસ લાખ ૯૭,૪૨,૯૭૩)- આરડીજીએસાં જુલાઈ, ૯૮૨૫૦૦૯૭૩૭ બેડી બંદર રોડ, બરેયર જાપનચર- ૩૬૧૦૦૨. તીસ પુરો જે તરીધ ર) દિશો રડ્યાર વિકલભાઈ પટેલ, ૦૧/૦૯/૨૦૧૧ હજા વેલ એકાઉટ વિસ્તોમાં સમય સાસોપાલવ, સેન્ટ પાંચે ચીક, જામનચર- ૩૬૧૦૦૨ રોક લોઝ સ્લોન હજા રૂપે છે સારીપ આસોપાલવ, સેન્ટ પાંચે ચીક, જામનચર- ૩૬૧૦૦૨ રોક લોઝ સ્લોન પુરો જે તરીખ ગેનીતામ દિશો રડ્યા પટેલ, ગા.૦૦ ગેનીતામ દિશો રડ્યા પટેલ. આંદ ઉત્પર્ધ કરે છે સો તોરેર પાર્થ બાખ બાન્સી સ્ટેસ સ્લોન પર કરે છે સે તો પ્રચ્લે છે સ્ટેસ સ્લોન પ્રચ્લે છે સ્ટેસ સ્લોન પ્રચ્લે છે સ્ટેસ કરે છે સ્ટેસ સ્લોન પ્રચા છે સ્લોન પ્રચ્લે છે સ્લોન સ્લોન સ્લોન સ્લોન વરે સ્ટેસ છે સો તોરે સ્લોન બાન સિરેસન સ્લોન પ્રચ્લે છે સ્લોન વરે છે સ્લોન વરે છે સ્લોન સ્લોન સ્લોન વરે સ્લોન ગરે છે સ્લોન સ્લોન સ્લોન સ્લોન સ્લોન સ્લોન છે સ્લોન સ્લોન સ્લોન સ્લોન સ્લોન સ્લોન સ્લોન સ્લોન છે સ્લોન સ્ટેસ સ્લોન સ્લો | કરજદારો/સહ- કરજદારો/જામીદારો/ ગીરવેદારોનું નામ | ૧૩(૨) માંગણા નોટીસની તારીખ અને રક્રમ | કુલ બાકી ૨કમ | અર્નેસ્ટમની જમાનીવિગત ઈએમડી વિગત | હરાજીની તારીખ અને સમય | સંપર્ક વ્યક્તિ અને નિરીક્ષણ તારીખ |
|--|---|--|---|--|--|---|
| મિલકતની વિગતો, રિઝર્વ પ્રાઇઝ રકમ અને ઈએમડી રકમ અને ઈએમડીની છેલ્લી તારીખ | (પાર્ટ. કિશોરકુમાર વિકલભાઈ પટેલ) બેડી બંદર કોડ, બોરેશર જામનગર- ઉક ૧૦૦૨. ૨) ડિશોરડુમાર વિકલભાઈ પટેલ, નાસોપાલવ , સેન્ટ પાંચે ચીંક, જામનગર- ઉક ૧૦૦૨ ૩)નીતાબે દિશોરડુમાર પટેલ, આસોપાલવ નેસ્ટ પાંચે ચીંક, જામનગર- ઉક ૧૦૦૨ ૧) કપુરીયા મિતેશ જી, જીએચી, રજીજાનગર, ડી- ૫, ૩૦૫, જામનગર કબ્જાનની તારીય અને કબ્જાનો પ્રકાર જાણમા હોય તેવા બોટા જાણમા હોય તેવા બોટા | (રેપિયા પચાસ લાખ ઓગણ્યાંસી હજાર ગીસ પુરા છે તારીખ ૦૮/૦૮?૨૨૧ ના કોર ક્લોઝર લોન એકાઉડર ને CDJAMTF 1403240008 મુજબ ઉપરોક્ત ને ચાર્જિસ સાથે ચુકની દેવી. માંગણ નોટીસની તારીખ: ૦૭/૦૫/2૦૨૧ | ૬૭, ૪ રે, ૬૭ રુ/- (રૂપિયા સરક્ષક લાખ બોતાલીસ હજાર છ સો તોતેર પુરા) જે તારીખ ૨ (૦૫/૨૦ ૨૩ ના એક્રાઇન્ટ નં. CDJAMTF 1403240008 મુજબ ઉપરોક્ત નિર્ધારિત વ્યાજ, કોસ્ટ અને ચાર્જિસ સાથે ચુકની દેવી. | આરીજીએવ; એનઈએકટીના માર્ગે નોચે જુસાવેલ સેકોન્ડ વિગતોમાં શ્રીરામ કાપનાન્સ વિચિટેના પાષા માં વસ્વાની સેકોરે. બોની નામઓસિસ લેંક સીચેટ બ્રાચ્ચ તે. રાષાકુપ્રસ્તન સલાપ માયલાપેર રોનાઈ બેક એક્રાઈન્ટ નં. કરેટ એક્રાઈન્ટ નં. કરેટ અંકાઈન્ટ નં. કરેટ અંકાઈન્ટ નં. કરેટ આઈએકએસસી કોડ- UTTB0000006 | જુલાઈ, ૨૦૨૩ અને સમય સવારે ૧૧.૦૦ થી બપોરે ૦૧.૦૦ વાગ્યા | રક જૂન. ૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી બપોરેઃ |

ામગઢામાં સમય કે આપે છે. આ ગામ કે આપે કે આપે છે. આ ગામ ગામ કે આ ગામ આપે આ ગામ આપે આ પ્રયાય મિલકત ૧: સ્વાવર વિચર્વિંગ સિરી વર્ષે નં. ૧૬ રાટી રાં ને સાંકે મુખ્ય માર્ટ વી ચાર્વે સે માય મેટિયા ૪૯.૪૨ સેવર માં જે બેલગાજી મંદિર પાસે, આસોપાલવ સ્ટ્રીટ જામનગ સ્વિત છે, તેની ચારે બાજુ: ઉત્તરે : મિલકત બિલરિંગ સીએસ નં. ૧૯૭: દક્ષિયે ટા મિલકત બિલરિંગ સીએસ નં. ૧૬, પુર્વે :રોડ સાઇડ સ્થિત, પથિમે : મિલકત બિલરિંગ સીએસ નં. ૧ સ્વિત પ્રાઇજ રૂદા ૧૩,૩૦,૦૦૦/- (રૂપિયા તેર લાખ ત્રીસ હજાર પુસ)

ામાં માટે પ્રા - 1999/900 (પ્રાપ્ત માં માય કાર 34) કેનેમી દેશ કો, 1: ગંડાવ્લાર્ગ (ગંડાવ્લા) એ લાખ તેવા હજા પુરા): બિક વૃદ્ધિ રૂદા ૨૦,૦૦૦/- (વીસ હજાર પુરા), ઈએમદીના સબમીશનની છેલ્લી તારીખ : 1લી જુલાઈ, ૨૦૨ સમય સવારે 10.00 વાગ્યા થી સાંજે 04.00 વાગ્યા સુધી

માં માર્ગ પ્રચાર મિલક્ત બિયરિંગ વેલેટ મેં ૩૦૫ માપ એરિયા ૪૪.૭૯ સ્કેવર મી. બિહા-અપ સ્થિત એટ પહેલો માળ , બ્લોક નંડીપ ગુજરાત હાઉસિંગ બોર્ડ હારા બનેલ લેન મિલરિંગ ઓટિઝગલ સર્વેનં ૧૫ અને બિયરિંગ સીએસ નં. ૧૦૫૫ ઓક શીટ નં. ૩૫૪ ઓક લાર્ડનં. ૧૫ ઓક સિટી સર્વેનં. હાથી કોલોની પાછળ, રજાજત નગર, જામનગર અને તેની ચારે બાજુ : ઉત્તરે : કલેટ નં. ૩૦૮: દક્ષિણે બ્લોક નંડી, શુદ્ધ રેઓ સ્ટોએસ અને રોડ, પથિમે : કલેટ નં. ૩૦૯, રિઝર્વ પ્રાઇઝ રૂડ. ૭,૨૩,૧૬૫/ (રૂપિયા સાત લાખ ત્રેવીસ હજાર એક પાસઠ પુરા)

ઈએમડી રકમ રૂા. ૭૨,૩૧૭/- (રૂપિયા બોતેર હજાર ત્રણ સો સતર પુરા)બિડ વૃદ્ધિ રૂા. ૨૦,૦૦૦/- (વીસ હજાર પુરા)ઈએમડી સબમીશન ની છેલ્લી તારીખ , ૧લી જુલાઈ, ૨૦૨૩ સમય વારે ૧૦.૦૦ વાગ્યા થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી.

સવાર 1000 બગયા થા સાજ 0પ.00 વાગ્યા યુધા. સિયોરિટી ઇન્ડેટને (પેનેકોસંને) દોમ્પર 2002માં વિશ્વ 2 (દો હેઠળ વેચાલ નોટીય માટે 30 દિવસીય નોટીસ. ગિરવેરારોડાજજારો,જાપીનદારોને મરાજાની તારીખ 02/03/2023 પહેલા કુલ માટી રકમ તોજ વડત વ્યાજ ચુકવવાની તક આપવામાં આવે છે, જેમે નિષ્ઠળ જતા મિલકતની હરાજ (વેચાય કરી બાકી રકમ વસુલાલે છે રકમ વસુલાશે તે વ્યાજ નથા કિંમન સાથે વસુલાત કરશે. વેચાયના નિયમ અને સરતોની વિગત માટે પૂચ્યા શ્રી રામ લાગતના લિમિટેની પ્રોલાઇટાં રેબમાલેટ https://www.shriramfinance.in/auctionની મુલાકાત લેવી.

સહી/- અધિકૃત અધિકારી શ્રીરામ ફાયનાન્સ લિમિટેડ સ્થળ : જામનગર તારીખ: ૦૧.૦૬.૨૦૨૩

જાત કરવામાં આવ્યુ. અવુ કહવામાં આવ્યું છે કે મલેશિયાએ કુઆલાલં પુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાકિસ્તાનનું વિમાન જપ્ત કર્યું છે.ભોઈગ ૭૭૦ છે દ્વારા મલેશિયા પાસેથી લીઝ પર હસ્તગત કરવામાં આવ્યું હતું. મ્સ્ૐ રજિસ્ટ્રેશન નંબર ધરાવતું વિમાન કુઆલાલંપુર એરપોર્ટ પર બીજી વખત બાકી રકમની ચૂકવણી ન કરવા બદલ જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરવાનો નિર્ણય સ્થાનિક કોર્ટ તરફથી બાકી રકમની ચુકવણી અંગેનો આદેશ મળ્યા બાદ લેવામાં આવ્યો છે.અગાઉ, મલેશિયાએ આ જ મદે વર્ષ

મલેશિયાએ \$ 4 મિલિયનની બાકી ચુકવણી ન કરવા બદલ પાકિસ્તાનનું બોઈંગ ૭૭૭ પેસેન્જર જેટ જપ્ત કર્યુ

FREE PRESS GUJARAT

256 spots waterlogged, 12 roads damaged

AHMEDABAD: Waterloggetu, 1.2 Yodus validatingeu AHMEDABAD: Waterlogging was reported from 256 spots in the city following heavy rain on Sunday evening. The city got about 3 inches of rainfall between 6pm and 10pm, which left 12 roads damaged, according to the AMC monsoon control room. Earlier this month, the AMC lidentified 45 spots where roads were likely to develop cave-ins due to digging by AMC for infrastructure works. A street pole and a tree collapsed near ESC Hospital in Naroda on Sunday evening. Leader of the opposition in the AMC.

ASHNISHA INDUSTRIES LIMITED

CIN- U74110GJ2009PLC057629 Regd. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mitkahali Six Roads, Ahmedabad 380006. Phone No. : 079-26463227. E-mail ID: ashnishailmited@gmail.com Website: www.ashnisha.in

E-mail LD: asnnsnalmittediggmall.com Website: www.ashnisha.u NOTICE OF EXTRA ORDINARY GENERAL MEETING, E-VOTING INFORMATION NOTICE is hereby given that the Extra Ordinary General Meeting (EGOR EGN) of the members of the Company will be held on Tursiday. 22nd Jun 2033 at 03:30 p.m. IST through Video Conferencing (YCC) / Other Aud Youal Means (CAWH) to transact the businesses as as out in the notice EGN in compliance with General Circular Nos. 14/020 (dated Bh Angl, 2020) ISD/2020 (dated ISM Angl, 2020) and 2020 (dated Bh Angl, 2020) ispect but Saved by the Ministry of Comparte Affairs (YNCA. Circular(S) and Circular Saved by the Ministry of Comparte Affairs (YNCA. Circular(S) and Circular Saved by the Ministry of Comparte Affairs (YNCA. Circular(S) and Circular Saved by the Ministry of Comparte Affairs (YNCA. Circular(S) and Circular Saved by the Ministry of Comparte Affairs (YNCA. Circular(S) and Circular Saved by the Ministry of Comparte Affairs (YNCA. Circular(S) and Circular Saved Biology (Circular) and SBB (Circular) whose email Las registered with the Company or the Registra and Save Transfer Aget (C their respective Depository Participant(S). REMOTE E-VOTINE: In compliance with provisions of Section 108 of the Companies Ad, 2013 read

THE E-VOTTINE: Joince with provisions of Section 108 of the Companies Act, 2013 rea le 20 of the Companies (Maragement and Administration) Amendmen Joilogiatons and Disclosure Requirements). Regulations, 2015, the nu's providing Is members, the facility to exercise their right to vide Data Ordinary General Meeting (EGM) by electronic means on all the Data Societary Company Company Company Company Societary Company Company Company Company Societary Company Company Company Societary Company Company Company Societary Company Company Societary Company are contained in the Notice of the boot contained in the Notice of the boot contained in the Provisions of Companies Act, 2013 and Rules a contained of the provisions of Companies Act, 2013 and Rules a contained of the provisions of Companies and contained of the contained of t

en hereunder: Cut-off date for the purpose of remote e-voting is 15th June, 2023. Period of e-voting: E-voting shall commence from 9:00 a.m. on 19 June, 2022 and ends at 5:00 p.m. on 21st June, 2023. Please note th remote e-voting will not be allowed beyond the above mentioned bir and date.

June, 2022 and ends at 2000 privile and the balve mentioned time and date. Peakors with an expanded barres and become member of the Company Peakors with belies of the EGM and balance states are not excited that is the LSM barres Academic and the states are not excited date i.e. 15th June, 2023, may cast their votes by following the instructions and process of remote evoting as provided in the Notece of EGM. Notice of EGM is available on vebsite of the Company (www.ashinshain) as well as website of CDSL (www.oxhingndia.com) A person, whose name appears in the Register of Members or in the feation by the extinct to an efficiency of member evoting as voting at the EGM. However, if the person is already registered with CDSL for membe evoting, then the existing User D and Ressword can be used for casting votes.

- remote evoluting, then the existing User Lia han ensaworu can be used acting votes, mitters attending EGM through VC/OAVM facility, who have not casted in votes by remote evoluting shall be able to ask their votes through e-mitters who have casted their votes by remote e-voting, may also and the EGM through VC/OAVM facility but shall not be edited to cast in votes again at the EGM through VC/OAVM facility but shall not be edited to cast the evolution, attending the EGM through VC/OAVM facility used the EGM through VC/OAVM facility to shall not be envioled in the tock of EGM. The same is available on the website of the Company washinkina, weshele of Cerral Depository Services India Ltd, at we evolutignidia.com and at the website of BSE Limited:
- www.bseindia.com. In case of any user relating to e-voting, members/beneficial owners may refer the frequently asked questions and e-voting user manual available at the devincida section of www.eotingnide.com or call on toll free no.: 1800 22 55 33 or send a request at hejdesk-e-outngües/disidia.com For, Ashinka I Industries Limited By order of Board Ashink C, Shah wre: Abmedabard Machine Limited Mach

Managing Director DIN: 02467830

Place: Ahmedabad Date: 31.05.2023



4

AHMEDABAD: India's largest bank, State Bank of India (SBI), has so far received Rs 14,000 crore the strong investor base SBI has created for itself in the worth of currency notes in Rs 2,000 denomination since May 23, when the Reserve Bank of India (RBI) announced withdrawal of the notes from

circulation over Kajasthan on Sunday claimed nine lives, said state government officials on Monday. As the circulation persists, several parts of Gujarat induding Ahmedabad are expected to receive rains on Monday and Tuesday. India Meteorological Department (IMD) officials said that this summer, the state has received 34.7 mm rains so far, which is about 10 times higher than normal. Major rainfall was caused by seven western disturbances and cyclonic circulations experienced by the state between March 1 and May 29, which is also much higher than normal. After the unexpected

the current year," he added. The SBI chairman also expressed confidence in expanding the bank's international banking vertical with the push for export-oriented manufacturing. SBI's international balance sheet of \$60 billion is expected to reach \$200 billion when India's GDP grows from the current \$3.5 trillion to \$5 trillion.

the current \$3.5 trillion to \$5 trillion. Speaking on Interest rate hikes, Khara expressed optimism that RBI would continue its pause on key rates. "With the inflation numbers we have seen recently, we expect that the RBI's pause on rate hikes will continue We need to closely. RBI's pause on rate hikes will continue. We need to closely monitor global scenarios and the RBI will also look at various aspects before taking the final call," he added.

Rain, thunderstorms kill nine in Gujarat

SBI

hailstorm washed out the IPL final match on Sunday, wary cricket lovers kept a a close watch on the weather forecast on Monday when the match was rescheduled at the Narendra Modi Stadium. Alok Kumar Pandey, the state relief commissioner, said that the state has recorded ine deaths due to thunderstorms and hailstorms on Sunday. Related report, & 5 The deaths included two on Sunday. Related report, & 5 The deaths included two each from Patan and Kheda districts, and one each from Ahmedabad, Bhavnagar, Banakkantha, Chhota Udepur and Botad districts. Majority of the cleaths were caused by 23-24. Set Sr. No. 1 Tender No. & Name of DRM-BRC 058 of 2023-24. Pratap Construction of 6 units Type IV & 11 pe III staff qua pe III staff qua prks in Pratag Type III start quarters including Ele works in Pratapage Railway of Approximate cost of the work (3,57,20,54,36,98 Uil Security) drive for (in 1), is also of Tonde opening of tender : Inders i submitted on 19,08,2023 before His, and is to be opened on same 15,30 Hrs. Website particular distance of the same see a A dire details can be seen & A dire form can be purchased: W @ www.imps.gov/in D/wiscone R Praterioan Valordan-4 WWEB

and Botad districts. Majority of the deaths were caused by lightning and torrential rains, said officials. Gujarat on Sunday had received major rainfall - 65 mm in Becharaji, 55 mm in Danta, 54 mm in Ahmedabad, 52 mm in Chanasma among others. In All, 91 talukas had received 1 mm or more rainfall. Several parts of the state including districts of north Gujarat and Ahmedabad city recorded Ahlistorm where halistones the size of large pebbles the size of large pebbles rained down on the city, giving the citizens a rare sight. For Ahmedabad city, it was the second highest single-day rainfall for a day in the month of May of all time. Manorama Mohanty, head of the India Meteorological Department Gujarat, said, "The rains are caused by subsequent spells of western disturbance and cyclonic circulations. This season is normal for western disturbance, but if we talk about the year in the past decade, it would reach Gujarat at the end of May or beginning of June. Instead, this year we have recorded an average three spells of western disturbances for the past three months that have brought substantial rainfall," she said. rained down on the city, giving she said. According to IMD fore-light to moderate rainfa expected in districts of n and central Gujarat along parts of Saurashtra Monday and Tuesday. The report mentioned the sta experiencing dual system experiencing dual system western disturbance a cyclonic circulation 1 Monday. The impact is to continue till Tuesday r WESTERN RAILWAY-VADODARA DI ENGINEERING DEPARTM "E" TENDER NOTICE CONSTRUCTION OF STAFF QUAI e-Tender Notice No. DRM-BRC

Reserve excluding Revalution Reserve Earning per share (before and after extraordinary items) Basic & Diluted : Date :- 30.05.2023

Place : Ahmedabad Date : 30-05-2023

each) cluding Re ation Re Earning Per Share (EPS) (of Rs. 10/- Each) (for 8 tinuing and discontinued operations) annualised (b) Diluted

Regd.Office: 501,For

(after tax)]

Particulars

 1
 Total income from operations (net)

 2
 Net Profit / (Loss) for the period (before Tax

 Exceptional and Extraordinary items)

 3
 Net profit / (Loss) for the period before Tax

(after Exceptional and Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)

6 Equity share capital (face value of INR 10)

tes: The above is an extract of the detailed format of Quarterly Financial Results field with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the stock exchange, website www.beelnda.com. In line with Ind 4 - 108 operating segments and basis of the review of operations being done by the senior Management, the operations of the group fall under Enterprise Segment which is considered to be the only reportable segment by the management. BY ORDER OF THE BOARD

(0.12)

(0.12)

SD/-Snehal Ajitbhai Patel Managing Director DIN : 03097321

0.14

0.14

ZEAL AOUA LIMITED CIN: L0500 9PLC05627

CLIN: LUDOUPGL2UU9PLLU962/0 Regd. Office: Block No. 347, VIII. Orma, Ta: Olpad, Surat, Gujarat 394540 India Tel.: +91-2621-220047, Email: zealagua@damail.com. Webster: www.realagua.com

| disturbance, but if we talk | 151 2021 22007, Endit 22000, Website, WWW.22000, and | | | | | | |
|--|--|------------------------------------|------------|-------------|------------|--------------|------------------------|
| about the year in the past | Extract of Audited Financial Result for the Quarter and Year ended 31st March, 2023 | | | | | | |
| decade, it would reach | | | | | | ount in Lakh | |
| Gujarat at the end of May or | SI. | Particulars | Quarter | Quarter | Quarter | Year ended | Year ended |
| beginning of June. Instead, | No. | | ended 31st | ended 31st | ended 31st | 31st March | 31 st March |
| this year we have recorded an | | | March | December | March 2022 | 2023 | 2022 |
| average three spells of | | | 2023 | 2022 | | | |
| western disturbances for the | | | (Audited) | (Unaudited) | (Audited) | (Audited) | (Audited) |
| past three months that have | 1 | Total Income from Operations | 6533.799 | 13381.070 | 10459.542 | 36268.737 | 34522.315 |
| | 2 | Net Profit / (Loss) for the period | 126.429 | 327.064 | 145.259 | 817.922 | 718.815 |
| brought substantial rainfall," | - | (before Tax, Exceptional and/or | | | | | |
| she said. | | Extraordinary items) | | | | | |
| According to IMD forecast, | 3 | Net Profit / (Loss) for the period | 126,429 | 327.064 | 145.259 | 817.922 | 718.815 |
| light to moderate rainfall is | 3 | before tax (after Exceptional | 120.425 | 327.004 | 14.3.2.33 | 017.522 | /10.015 |
| expected in districts of north | | and/or Extraordinary items) | | | | | |
| and central Guiarat along with | | and/or extraordinary items) | | | | | |
| parts of Saurashtra on | | | | | | | |
| Monday and Tuesday. The IMD | 4 | Net Profit / (Loss) for the period | 126.429 | 327.064 | 51.158 | 705.355 | 574.714 |
| report mentioned the state is | | after tax (after Exceptional | | | | | |
| experiencing dual systems of | | and/or Extraordinary items) | | | | | |
| western disturbance and a | 5 | Total Comprehensive Income | 126.429 | 327.064 | 51.158 | 705.355 | 574.714 |
| cyclonic circulation from | | for the period [Comprising | | | | | |
| | | Profit / (Loss) for the period | | | | | |
| Monday. The impact is likely | | (after tax) and Other | | | | | |
| to continue till Tuesday night. | | Comprehensive | | | | | |
| WESTERN RAILWAY-VADODARA DIVISION | | Income(after tax)] | | | | | |
| ENGINEERING DEPARTMENT | 6 | Equity Share Capital | 1260.660 | 1260.660 | 1260.660 | 1260.660 | 1260.660 |
| "E" TENDER NOTICE | 7 | uation | - | - | - | 5,814.265 | 5,120.520 |
| CONSTRUCTION OF STAFF QUARTERS | <i>'</i> | Reserve) as shown in the | | | | 5,014.205 | 5,120.520 |
| e-Tender Notice No. DRM-BRC 058 of | | Audited/Unaudited Balance | | | | | |
| 2023-24. Sealed Tenders for and on behalf of the President of India are invited | | Sheet of the previous year * | | | | | |
| by Divisional Railway Manager (WA/C), | 8 | Earnings Per Share (face value | | | | | |
| Western Railway, Prataphagar, Vadodara-390004 for the following works, | • | of Rs. 10/-each) (for | | | | | |
| Sr. No. 1 Tender No. & Name of Work: | | | | | | | |
| DRM-BRC 058 of 2023-24. Pratapnagar | | continuing and discontinued | | | | | |
| Construction of 6 units Type IV & 11 Units Type III staff quarters including Electrical | | operations) | | | | | |
| works in Prataphagar Railway colony. | | 1. Basic | 0.100 | 0.259 | 0.041 | 0.560 | 0.456 |
| Approximate cost of the work (in ₹) : | | 2. Diluted | 0.100 | 0.259 | 0.041 | 0.560 | 0.456 |
| | Note: | | | | | | |
| time for submission of tender and | The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Regulations). Regulations, 2015. The full format of the Quarterly/Annual | | | | | | |
| submitted on 19.08 2023 before 15.00 | Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at | | | | | | |
| Hrs., and is to be opened on same date at | www.zealagua.com, | | | | | | |
| | The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 30th May, 2023. | | | | | | |
| notice for location where complete details can be seen & Address of | 3. The figures for the guarter ended March 31, 2023 and March 31, 2022 are the balancing figures between audited figures in respect | | | | | | |
| the office from where the tender | of the full financial year and the published year to date figures upto the end of third quarter which was subjected to Limited Revie | | | | | | Limited Review. |
| form can be purchased: Website | For Zeal Aqua Lin | | | | | | |
| @ www.ireps.gov.in Divisional Railway Manager (WA/C), Western Railway, | Des distances De Mister | | | | | Sd | |
| Pratapnagar, Vadodara-4. W/623/NIT of | Praupkumar Ratilala Nav | | | | | | |
| 2023-24 GateG 20.03.2023 61 | | | | | | | |
| Like us on: 📑 facebook.com/WesternRly | Place, Surac DIN, 01007/10 | | | | | | |

Shriram Finance Limited SHRIRAM

Head Office: Level-3, Wockhardt Towers, East Wing C-2 Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051; Tel: 022 4241 (4040, 022 4060 3100; Website: http://www.shriamfinance.in Registered Off.: Sri Towers, Piot No. 14A, South Phase Industrial Estate, Guindy, Chennai 600 032; Branch Off: #403-404, 3rd Eye Complex, Above Saraswat Ban Panchvati Cross Road, C.G Road, Ahmedabad-380006

APPENDIX-IV-A [SEE PROVISION TO RULE 8(5) & 9(1)] AUCTION NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES NOTE: It is informed that "SHRIRAM CITY UNION FINANCE LIMITED" has been amalgamated with "SHRIRAM TRANSPORT FINANCE LIMITED" as per order of NCLT, Chennal. Subsequently the name of "SHRIRAM TRANSPORT FINANCE LIMITED" was changed as "SHRIRAM FINANCE LIMITED" with effect from 30.1 x 2022 wide Certificate of Incorporation pursuant to change of name date3 0.0 1-2022.

effect from 30.11.2022 vide Certificate of Incorporation pursuant to change of name dated 30.11-2022. E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Inte Act, 2002 read with provision to Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to public In operating and pursues (Enforcement) Rules, 2002. Notice is hereby given to public In operating and public programme and the Notice is hereby given to public In operating and the Notice Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to public In operating and public programme and with have been taken by the Authorized Officer of Stringer Finance Limited, The physical possession of which have been taken by the Authorized Officer of Stringer Finance Limited, The physical possession of which have been taken by the Authorized Officer of Stringer Finance Limited, and Stringer Finance Limited, and Stringer Finance Limited, Stringer Finance Limited, Stringer Finance Limited, Stringer Finance Limited, and Stringer Finance Limited, String n of the

| infinovable property and encumbrances known there | ion, possession type | pe, reserve price and ear | nest money deposit and increm | ent are als | o given as | | |
|---|---|--|--|---|---|--|--|
| Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortgagers | Date & Amount of 13(2) Demand Notice | Total Outstanding Amount | Earnest Money Deposit Details (EMD) Details. | Date & Time of Auction | Contact Person and Inspection date | | |
| 1).Shiv Sagar Medical Store ,Prop: Jaydipsinh Wolthai Sagar). T. Madhuvan Commercial Centre ,Dop.S.T.Bus Stand, Bavla, Ahmedabad-S82220 2). Jaydipsinh Moltbhai Sagar, 3). Molthai Vaghubhai Sagar 4). Sagar Chintan Moltbhai 5).Sagar Saraswati Chintan All Are Ri, oo 7 Madhuvan Society At.Bavla, Tatuka Bavla, Dist Ahmedabad-382220 Date of Possession Type 05/04/2022 - Physical Possession Encumbrances known AS IS WHERE IS', "AS IS WHAT IS", "WHATEVER THERE IS', "AS IS WHAT IS", | Rs.3,58,49,5 38/- (Rupess Three Crore Fifty Eight Lakhs Forty Nine Thousand Five Hundred Thirty Eight only) Notice dated: 30/10/2021 | Rs.495.76, 332/- (Rupeas Four Crore Ninety Five Lakhs Seventy Six Thousand Three Hundred and Thirty Two Only) as on 25th May 2023 Loan Account No. 20AHTTF19040400 03, excluding further interest, legal and charts costs | EMD amount to be deposited by way of RTGS/ NEFT to the account details mentioned herain below in favour of Shriram Finance Limited BAIK NAME- AXIS BANK LIMITED BAIK AME- AXIS BANK LIMITED BAIK AME- AXIS BANK MUTLAPORE, CHENNAI BAIK ACCOUNT NO- 006010200067449 IFSC CODE- UTI80000006 | 17th June 2023 & Time. 11.00 a.m. to 01.00 p.m. | Mr. Kamlesh Chauhar 9825006737 Mr. Hitesh Sonara 7777999027 Mr. Debiyothi Roy - 9874702021 Property Inspection 14th June 2023 Time 11.00 a.m. to 1.00 p.m. | | |
| Description of Property, Reserve Prise amount & EMD Amount & EMD last date | | | | | | | |
| Property 1:All the piece and parcel of Non Agriculture land bearing New Block Survey No.1611 (Old Survey No.2024, Spik) admeasuring 20234 sq.mtrs. palki 15000 sq.mtrs. of Mouje BAGODARA Taluka Bavia in the District Of Ahmedabad and Registration Sub-Distract Of Bavia within the state of Gujarat, The said land is Bounded as Under: East:-Old Survey No.204 & 206, West:-Road, North:-Old Survey No.202, South:-Old Survey No.204. Reserve Price Is Rs. 1, 43, 23,000/ (Rupess Dne Crore Forty Three Lakis Twenty Three Thousand Only) FMD amounties Rs. 1, 23, 2010/ (Rupess Fourtean Lakis Thirty Tum Thousand and Three Underd Faur Only): | | | | | | | |

imb amount is Hs. 14,32,300/-(Hupees Fourteen Lakhs Thirty Two Thousand and Three Hundred Four Uniy);; Bid Increment Rs.50,000/-(Fifty Thousand Only), Last Date for Submission of EMD. 16th June '2023, Time 10.00 a.m. to 05.00 p.m.

Property 2: All the piece and parcel of Non Agriculture land bearing New Block Survey No.1618 (Old Survey No.200 paiki) admeasuring 8000 sg.mtrs. paik Mouje BAGODARA Taluka Bavla In the District Of Ahmedabad and Registration Sub-Distract Of Bavla within the state of Gujarat, The said land is Bounded as Under : East:-Road, West:-Block/Survey No.199, North:- Block/Survey No.198, South:-Block/Survey No.201

Junar . Last - rua, rest. - double surrey fra: reg s, runit -- budy surrey fra: reg , south - budy surrey fra: reg , runit - budy Reserve Price is fra, 76,77,000/- (Ruppee Sevent) St Lakis Sevent) Seven Thousand Only . END amountis R. 7,67,7000/- (Ruppee Sevent) St Lakis Sity Seven Thousand and Seven Hundred Only Bid Increment Res, 50,000/- (FINT budy surrey frait Lakis Sity Seven Thousand and Seven Hundred Only) Bid Increment Res, 50,000/- (FINT budy surrey frait Lakis Sity Seven Thousand and Seven Hundred Only)

STATUTARY 15 DAYS NOTICE UNDER RULE 9 (1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

a bit of unit is out a outraining out out the set of Place : Ahmedabad Date : 01-06-2023 Sd/- Authorised Office Shriram Finance Limited



Rs 14k cr in Rs 2,000

notes deposited: SBI

339.75 339.75 223.13 339.75 206.12 (0.0) 0.56 0.9

arch 31, 2023

Audited Audite

48.6

32.10

30.5

26.14 48.6

26.14

18.93

17.01

cept

 Quarter ended
 Year ended

 31.03.2023
 31.12.2022
 31.03.2022
 31.03.2023
 31.03.2023

444.02 1,603.31 1,624.0

7.09

7.09

(0.65

(3.05

Unaudited

409.18

6.74

6.74

5.29

5.50

339.75

0.1

Nates: The above is an extract of the detailed format of Quarterly Financial Results filled with the stock exchanges under Regulation 33 of the SBB (Using and other Disclosure Regulements) Regulations 2015. The full format or Quarterly Financial Results are evaluable on the Stock Exchange vestime www.basinda.com and also on the Comparity Vestime to www.absinda.com and above the Above Stock and the Sto Above results wer on May 30, 2023. By order of the Board Sd/-

ASHISH POLYPLAST LIMITED une Business Hub,Nr.Shell Petrol Pump,Science City Road,Ah Phone : 90990 52582, E-Mail: ashishpolyplast@gmail.com CIN : L17110GJ1994PLC021391

Financial Results for the Quarter ar

379.95

2.60

2.60

1.12

(1.40

339.75

0.03

- Sd Ashish D Panchal Chairman & Managing Director DIN : 00598209

-668.31

(0.59)

(0.59)

| TRAC | T OF AUDITED | FINANCIAL | RESULTS FOR | QUARTER-IV A | | | T MARCH,2023 Except EPS data) |
|-------|--------------|-----------|-------------|-------------------------------------|-----------------|-----------------------------------|--|
| . No. | | Particul | ars | Quart Ende 31/03/2 (Audite | d Ye 1023 31 | ar Ended I/03/2023 Audited) | Quarter Ended 31/03/2022 (Audited) |

| Place | :-Ahmedabad | | [| DIN : 005982 |
|---------|--|---|---------------------------------------|-------------------------------------|
| | AROMA ENTERPRISES g Off : 88, Ajanta Commercial Center Nr. Income T IN : L51909GJ1994PLC021482 Phone : 079-2754C | ax Circle, Ashr 175 E-mail Id | am Road Ahmed | abad -380009 |
| EXTRAC | website : www.aroma | | EAR ENDED 31 (Rs. In Lakhs | |
| Sr. No. | Particulars | Quarter Ended 31/03/2023 (Audited) | Year Ended 31/03/2023 (Audited) | Quarter En 31/03/202 (Audited |
| 1 | Total Income From Operation | 0.00 | 0.00 | 35.66 |
| 2 | Net Profit for the period (before tax and exceptional items) | (5.74) | (28.81) | 6.73 |
| 3 | Net Profit for the period before Tax (after exceptional items) | (5.74) | (28.81) | 6.73 |
| 4 | Net Profit for the period after tax (after Exceptional items) | (5.78) | (29.19) | 6.69 |
| 5 | Total Comprehesive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | | (29.19) | 6.69 |
| 6 | Equity Share Capital (Face Value of Rs.10/- | 494.04 | 494.04 | 494.04 |

| withdravial of the notes from dirculation, according to the bank's chairman, Dinesh Khara. He was at GIFT-IFSC in Gandhinagar on Monday for the listing ceremony of SBTs foreign currency bonds. "Since the RBI announcement, SBI has received Rs 14,000 crore worth of Rs 2,000 currency notes as deposits whereas Rs 3,000 crore were exchanged at the bank through its branch network. Generally, we are about 20% of the market," Khara told media persons on the sidelines of the caremony. SBI on Monday listed foreign currency bonds of \$750 million under its \$10 biblion Global Medium Note Programme on India INX's global securities market. (GSM) at CIFT IFSC in Gandhagar. "As the listing ceremony vide window given for exchange, people are not anxious;" people are not anxious; he didding ling didda INX under its \$10blion global INX under its \$10blion global | aross geographies resulting in the largest, spread compression amongstall USD- Indian bonds issuance during Rain, thun kill nine issuance during Rain, thun kill nine issuance during kill nine kill nine |
|--|--|
| INX under its \$10 billion global | seven western disturbances |